

B.A. Semester - 5 (CBCS) Examination

Oct/Nov. - 2018

ECONOMICS : P14 INTERNATIONAL ECONOMICS - 1 (CORE/EC-14)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્વ સવિસ્તાર સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તફાવત સમજાવો.
- પ્રશ્ન-૨ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ વિનિમય દર નિર્ધારણનો સમખરીદ શક્તિનો સિદ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૩ સ્થિર વિનિમય દર એટલે શું? તેની તરફેણની દલીલો કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ લેણદેણની તુલાના ખાધનાં કારણો જણાવો.
- પ્રશ્ન-૪ મુક્ત વ્યાપારનાં લાભાલાભ ચર્ચો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ સંરક્ષણનો અર્થ જણાવી, બાળ ઉદ્યોગની અને રોજગારીનાં સર્જનની સંરક્ષણની દલીલો તપાસો.
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો. (કોઇપણ બે) (૧૪)
(૧) પાસ્પરિક માંગનો સિદ્ધાંત (૨) આયાત જકાત અને આયાત ક્વોટા.
(૩) પરિવર્તનશીલ વિનિમય દરની તરફેણની દલીલો. (૪) અવમૂલ્યન.

ENGLISH VERSION

- Que-1 Explain in detail the importance of inter-national trade. (14)
OR
- Que-1 Explain the difference between internal trade and inter-national trade
- Que-2 Explain the comparative cost theory of inter-national trade. (14)
OR
- Que-2 Explain the purchasing power Parity theory regarding exchange rate determination.
- Que-3 What is meant by the fixed exchange rate? Show the arguments in its favour. (14)
OR
- Que-3 Give reasons for deficit of balance of payment.
- Que-4 Discuss the advantages and disadvantages of free trade. (14)
OR
- Que-4 Give the meaning of protection and examine the arguments favouring the protection for infant industry and creating employment.
- Que-5 Write Short Note. (Any two) (14)
(1) The theory of reciprocal demand.
(2) The tariff and quotas.
(3) Arguments favouring of the flexible exchange rate.
(4) Devaluation.
